



BRAMPTON

Service and Information Update

ફેમિલી ડે 2020 ઈન બ્રેમ્પટન (બ્રેમ્પટનમાં કુટુંબ દિવસ 2020)

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ફેબ્રુઆરી 11, 2020) – ફેમિલી ડે આપણાં સમુદાયમાં કુટુંબોના મહત્વને ઓળખે છે અને રહેવાસીઓને પોતાના પ્રિયજનો સાથે સમય વિતાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે!

આ વર્ષે, ફેમિલી ડે સોમવાર, ફેબ્રુઆરી 17, 2020 નાં રોજ યોજવાનો છે, અને પરિણામ સ્વરૂપે, શહેરની સંખ્યાબંધ સેવાઓ અનુપલબ્ધ રહેશે અથવા ઘટાડેલા સેવા સ્તરો સાથે કાર્યરત રહેશે.

બ્રેમ્પટન સીટી હોલ ફેમિલી ડે નિમિત્તે બંધ રહેશે. રહેવાસીઓ આ સમય દરમિયાન રૂબરૂમાં મેરેજ લાઈસન્સીસ મેળવવા અરજી કરી શકશે નહિ, નાગરિક લગ્ન સમારોહોનું બુકિંગ કરાવી શકશે નહિ, પાર્કિંગ ટંડ ચૂકવી શકશે નહિ અથવા પરમીટ્સ મેળવવા કે તાજી કરવા અરજી કરી શકશે નહિ અથવા બિઝનેસ લાઈસન્સીસ (ધંધાકીય પરવાનાઓ) માટે અરજી કરી શકશે નહીં.

ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ, સીટી ઓફ બ્રેમ્પટન બાય-લો એન્ફોર્સમેન્ટ અને એનિમલ કંટ્રોલ સહિતની, સંખ્યાબંધ સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.

રહેવાસીઓ કોઈ પૂછપરછો માટે 311 અથવા 905.874.2000 (બ્રેમ્પટન બહાર) નંબર પર ફોન કોલ કરી શકે છે, Brampton 311 એપનો ઉપયોગ કરી શકે છે (App Store અથવા Google Play પર ઉપલબ્ધ) અથવા 311@brampton.ca ઈમેઈલ સરનામે ઈમેઈલ મોકલી શકે છે. અમે પાર્કિંગ, કચરો એકત્રીકરણ, મનોરંજનલક્ષી કાર્યક્રમો અને અન્ય ઘણી બાબતો સહિત, સીટી ઓફ બ્રેમ્પટન કે રીજીયન ઓફ પીલને સંબંધિત બાબતો માટે 24/7 ઉપલબ્ધ રહીએ છીએ.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ

ફેમિલી ડે પર બ્રેમ્પટન ટ્રાન્ઝિટ રવિવાર/રજાના દિવસની સેવા પૂરી પાડશે. અમારા ટર્મિનલ્સ પર ગ્રાહક સેવા કાઉન્ટર્સ બંધ રહેશે.

રૂટ અને સમયપત્રક માહિતી માટે, 905.874.2999 નંબર પર ફોન કોલ કરો અથવા વેબસાઈટ જુઓ, www.bramptontransit.com. રિયલ-ટાઈમ (વાસ્તવિક સમયે) આગામી બસ માહિતી મેળવવા તમારા સ્માર્ટ ફોન કે અન્ય મોબાઈલ સાધન પર વેબસાઈટ nextride.brampton.ca જુઓ. અન્ય ટ્રિપ આયોજનને લગતા સાધનો માટે વેબસાઈટ www.triplinx.ca અથવા Google Maps (ગૂગલ મેપ્સ) જુઓ.

બ્રેમ્પટન રિક્રિએશન

વિવિધ મોજમજાની, કુટુંબને અનુકૂળ પ્રવૃત્તિઓ માટે અમારી સાથે તમારા પડોશના કમ્યુનિટી સેન્ટરમાં જોડાશો. પ્રવૃત્તિઓનું સંપૂર્ણ સમયપત્રક ઓનલાઈન અહીં જુઓ www.brampton.ca/recreation.

બ્રેમ્પટન એનિમલ સર્વિસીસ

બ્રેમ્પટન એનિમલ શેલ્ટર ફેમિલી ડે નિમિત્તે બંધ રહેશે. વધુ માહિતી મેળવવા, 905.458.5800 નંબર પર ફોન કોલ કરો અથવા વેબસાઈટ જુઓ, www.brampton.ca/animalservices.



BRAMPTON

Service and Information Update

ब्रेम्पटन लाइब्रेरी

ब्रेम्पटन लाइब्रेरीनी तमाम शाखाओ इमिली डे निमित्ते बंध रहेशे. तमारा इमिली डे नां भाग तरीकि, स्ट्रीमिंग मूवीस अने म्युजिक अजभावी लुओ, अथवा ईबुक वांचो! अमारा डिजिटल उत्पादो, कार्यक्रमो अने सेवाओ अंगे वधु माहिती मेणववा वेबसाईट www.bramptonlibrary.ca लुओ अथवा 905.793.4636 नंबर पर फोन कोल करो.

-30-

मिडिया संपर्क :

मोनिका दुग्गल

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी अंगेजमेन्ट

व्यूहात्मक संवाद

सीटी ओइ ब्रेम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca